

"નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂર્યે
Jainuniversity.org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત

સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણા તથા આશીર્વાદ દાતા : જિન શાસન શાણગાર પરમ પૂજ્ય
આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મં. સાન્ના શિષ્યરત્ન સરસ્વતી સાધક
પં. પૂ. આચાર્ય ભગવંત શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
સચોટ સવાલના સચોટ જવાબો - અંતર્ગત જ્ઞાન પ્રતિભા ધારક વિજેતાનો જવાબ
અને અન્ય સ્પર્ધકોના જવાબ"

સવાલ નંબર 9

👉 સવાલ નંબર-9 પૂર્વભૂમિકાઃ બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... સવાલઃ જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાથેસાથ શું શું કરવું જોઈએ?

👉 પ્રશ્ન સંખ્યા 9. पृष्ठभूमि: सभी दुखों की जड़ में, अज्ञानता, आग्रह और अहंकार है जो कि एक व्यक्ति खुद स्वीकार नहीं कर सकता है फिर भी... एक ज्ञानी और सुखी जीवन बनाने के लिए वास्तव में क्या किया जाना चाहिए?

WINNER - Q 9: ASHA MEHTA (62) JAMNAGAR GUJARAT

WINNER'S ANSWER :

Asha Mehta (62) Jamnagar Gujarat

જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા સાથેસાથ શું કરવું જોઈએ?
માનવ જાતિ એટલે જ્ઞાન મન અને બુદ્ધિ પ્રદાન પ્રાણીઓનો સમુદાય.એ જ્ઞાન વિપરીત માર્ગે તણાઈ ન જાય એ જોવાની સૌથી મોટી ફરજ છે. પ્રથમ તો બચવું જોઈએ "વિપરીત શ્રદ્ધા" થી. -જ્ઞાનને સમ્યક બનાવનાર શ્રદ્ધા. -શ્રદ્ધા સમ્યક બનાવનાર જ્ઞાન.
દુન્યવી લોભ ક્યારેય સુખમય જીવન ના આપી શકે. અને માટે જ નિસ્પૃહ નિરપેક્ષ થઈએ તો જ સાચું સુખમય જીવન મળે.તે મેળવવા....."પરિસ્થિતિનો સ્વીકાર".....everything take it easy.....તેમાં પ્રથમ ... "સંતોષ " અને બાદમાં "સાચી સમજણ" ... કે મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે મારા જ કરેલા કર્મનું ફળ છે. તે સમજણ થઈ જાય તો જ સુખમય જીવન પસાર થાય બાકી સંસારમાં જ્યારે આવેગોનું તોજ્ઞાન જાગે અને પ્રતીતિનું સુકાન હાથમાંથી સરી જાય તો બુદ્ધિની ચમક ઝાંખી પડી જાય. આપણે તોજ્ઞાનોનો સામનો ના કરી શકીએ...માનસિક નિર્ભરતા પણ ભાંગી નાખે ત્યારે આપણે સમજવું જોઈએ કે સાચું જ્ઞાન અને જ્ઞાનમય અને સુખમય જીવન જીવવા માટે પરિસ્થિતિનો સ્વીકાર કરી સમતાપૂર્વક ધાર્મિક જીવન જીવવું જોઈએ. દુઃખનું સ્થાન ચાર ગતિ રુપ સંસાર છે આધિ-વ્યાધિ-ઉપાધિ તે ભરપૂર છે જ્યાં સુધી એ સંસાર પરિભ્રમણ મટે નહીં ત્યાં સુધી દુઃખનો અંત આવે નહીં.માટે શ્રી અરિહંત પરમાત્માએ જ્ઞાનમાં જોયું છે કે એમના માર્ગે ચાલનાર દુઃખી રહે જ નહીં.ચથાર્થ શ્રદ્ધાના અભાવે ચાર ગતિના દુઃખો ભોગવી રહ્યા છે...જ્ઞાનીએ બતાવેલા માર્ગ મા ચાલવાના જ સુખ અને કલ્યાણ છે.

સવાલ નંબર 9

👉 સવાલ નંબર-9 પૂર્વભૂમિકા: બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... સવાલ: જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાથેસાથ શું શું કરવું જોઈએ?

👉 પ્રશ્ન સંખ્યા 9. પૃષ્ઠભૂમિ: સમી દુખોં કી જડ મેં, અજ્ઞાનતા, આગ્રહ ઓર અહંકાર હૈ જો કી એક વ્યક્તિ ખુદ સ્વીકાર નહીં કર સકતા હૈ ફીર બી... એક જ્ઞાની ઓર સુખી જીવન બનાવે કે લીએ વાસ્તવ મેં કયા કયા જાના ચાહીએ?

TOP-2-Rita Shah (58) Hyderabad

જય જિનેંદ્ર જય ગુરુદેવ
સમી દુખોં કી જડ કો દૂર કરના હૈ તો અજ્ઞાનતા કો પહલે દૂર કરના જરૂરી હૈ
ઉસકે લીએ હમેં આત્મા કા ફેશિયલ સબસે પહલે જિન વાળી રૂપી ક્રીમ કે સાથ
કરના જરૂરી હૈ ઓર રગડ રગડ કે માલિશ કરના ચાહીએ જિસસે કસાઈ કે
આવરણ સે બંદ આત્મા કે છિદ્ર ખુલ જાએંગે ઓર ફિર તપ રૂપી ભાપ હાસિલ હોંગી
તો કર્મ રૂપી પસીના બાહર આ જાએંગા જિસે શાંતિ રૂપી રુમાલ સે સાફ કર લેના
ચાહીએ ઓર એક લેપ બનાકર ઉસમેં સુદેવ સુગુરુ સુધર્મ કી શ્રદ્ધા મિલાકર
સમકિત રૂપી તૈયાર કરકે ઉસે સહનશીલતા કે બ્રશ સે લગાના ચાહીએ ઓર જબ
તક લેપ અંદર તક ના જાએ તબ તક રહને દેના ચાહીએ ઓર જબ લેપ અંદર તક
ચલા જાએ તબ બાહર હી લેપ કો આગમ રૂપી પાની સે ધો લેના ચાહીએ અબ આત્મા
પર સે મિથ્યાત્વ ઓર અહંકાર કષાય કા મૈલ સાફ હો જાએંગા ઓર આત્મા નરમ
ઓર મુલાયમ બન જાએંગી સુખી ઓર જ્ઞાની જીવન બનાવે કે લીએ આત્મા કો
શુદ્ધ ઓર સ્વચ્છ કરના ચાહીએ।
ધન્યવાદ
રીટા શાહ
9394027175
હૈદરાબાદ, તેલંગાના।

TOP-3-Chandresh Mehta (57) Malad
Mumbai, Maharashtra

જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા અભિમાન અને આગ્રહવૃત્તિ છોડી જ્ઞાન
પ્રાપ્તિના પંથે પ્રયાણ કરવું જોઈએ. જિન વચનોમાં આત્માનું સુખજ પરમસુખ છે.
સામાજિક જીવનમાં વણાયેલા સુખો પાપોનું ઉદ્દગમ સ્થાન છે જેને જૈન ધર્મમાં ક્યાંય
સ્થાન જ અપાયું નથી.
દુનિયા ભરના ભોગ સુખો ભેગા થઈ જાય તો પણ જીવને તૃપ્તિ થતી નથી માટે
અસંયમથી જે આનંદ મળે તેને ઘિક્કારવું જોઈએ અને સંયમથી જે આનંદ મળે તેને
આવકારવું જોઈએ જેથી જીવન સુખમય બની જશે. સુખ માટે દોડ પણ રસ્તો સમજી
લે જે માત્ર આત્મજ્ઞાનનો જ છે. સુખ માત્ર હળવાશમાં છે અને તેનો ઉપાય માત્ર
વિરતી છે. જો સુખનો જ લોભ રાખવો હોય તો મહામુલા ત્રણ રત્ન સમ્યકદર્શન,
સમ્યકજ્ઞાન, સમ્યકચારિત્રનો જ રાખવો જોઈએ.
હે જીવ! તું ભીતરી તત્વોને ઓલખી લે એ જ જ્ઞાનની ચરમસીમા છે. જ્ઞાનનો
સાર ફક્ત એટલો જ છે કે તું અહિંસક બનીજા જેથી સમ્યક રીતે ઉપાર્જિત થયેલું
જ્ઞાન તારું રક્ષણ કરશે. શુભાશય પુર્વક થયેલી ધર્મક્રિયા, સત્સંગ અને સદ્વાચન
જ્ઞાનની વૃદ્ધિ કરનારું છે. જ્ઞાન પામતા જીવનમાં વિનય, દયાળુ ગુણાનુરાગી વિગેરે
ગુણોનો વિકાસ થશે જે સુખમય જીવન બનાવવા માર્ગ પથક બનશે.
" જિન વચનો દ્વારા પ્રાપ્ત થતાં આત્મજ્ઞાનના રંગે રંગાઈ જા તારું જીવન
જ્ઞાનમય અને સુખમય બની જશે."

સવાલ નંબર 9

👉 સવાલ નંબર-9 પૂર્વભૂમિકા: બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... સવાલ: જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાથેસાથ શું શું કરવું જોઈએ?

👉 પ્રશ્ન સંખ્યા 9. પૃષ્ઠભૂમિ: સમી दुखों की जड़ में, अज्ञानता, आग्रह और अहंकार है जो कि एक व्यक्ति खुद स्वीकार नहीं कर सकता है फिर भी... एक ज्ञानी और सुखी जीवन बनाने के लिए वास्तव में क्या किया जाना चाहिए?

TOP-4-Kanjibhai Maheshwari (80)
Gandhidham-Gujarat.

માનવમાત્ર સુખમય જ્ઞાનમય જીવન ઈચ્છે છે .અને તે માટેની તેની ગતિ હોય છે . પરંતુ અનંતભવના બંધાયેલાં કર્મોથી તેને સુખ કે . દુઃખ ભોગવવું પડે છે . સંસારનાં ભૌતિક સુખમા માણસ અટવાઈ જઈને કર્મ ખપાવવાનુ ભૂલી જાય છે .એક તો જમાપૂજી રુપે શુભાશુભ કર્મોનો ગોડાઉન ભરેલો છે .આને વળી વર્તમાનમાં બીજા શુભાશુભ કર્મોનો ખડકલો વધ્યા કરે છે .પરિણામે સાચું સુખ સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી .એટલા માટેજ ધર્મ માણસને તેની ચાલવાની ગતિ ફેરવે છે .સંસારી સુખ માંથી પ્રભુ ભક્તિ માર્ગ તરફની ગતિએ વાળે છે . ભક્તિથી માણસની અંતરશુદ્ધિ થાય છે .ભક્તિ કરતાં સાધક કહે છે ,હે પ્રભુ !તમે જે સ્વરુપે છો ,તે પ્રભુતા (પૂજ્યતા) મારામાં પ્રકટ થાય . આ ભાવશુદ્ધિ ભક્તિ થી કર્મોની નિર્જરા થાય છે .પાપકર્મો ખપાતા ખપાતા આખરે સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં જ્ઞાનમય સુખમય જીવન બની શકે છે .જીવન આનંદમય, પ્રસન્નતાથી ભરપૂર બને છે! મિચ્છામી દુક્કડમકાનજી મહેશ્વરી . ઉંમર વર્ષ,11૮0,કચ્છ ગાંધીધામ . મો.7984995629 તા.8/8/2020શનિવાર.

TOP-5-Purvi Shah (43) Mooresville, Nc

"જ્ઞાન સમો કોઈ ધન નહીં, સમતા સમુ નહીં સુખ,
જીવિત સમી આશા નહીં, લોભ સમો નહીં દુઃખ."
આત્માને પરમ સુખની ઈચ્છા હોય છે. જ્ઞાની વ્યક્તિએ ધર્મ મોક્ષ પામવા માટે કરવો જોઈએ. સુખની પૂર્ણતાનું નામ મોક્ષ છે.સુખ એ વ્યવહાર ભાષા છે. આત્મા સુખનો સ્વામી નહીં આનંદનો સ્વામી હોવો જોઈએ.આનંદ પ્રગટ કરવા માટે આપણી પાસે ચાવી છે. કર્મનો કાળ આત્મા પર તીવ્ર છે. આત્મા ને સાચી સમજણ માત્ર જ્ઞાન દ્વારા મળશે. જેમ જેમ ધર્મ પ્રત્યેનું આપણું આચરણ વધતું જશે આપણી આરાધના વધતી જશે તેમ તેમ આપણે મોક્ષની નજીક જશું.
ક્રિયા એ સાધના છે ,જેમાં જીવદયા,અહિંસા નો અંશ એ આરાધના છે.તેમાં સાવધાની,અપ્રમત્તતા એ જિનવચનની ઉપાસના છે,અને એમાં એકાકાર થવું એ પ્રભુની પૂજા છે. આમ જ જ્ઞાન દ્વારા આરાધના કરશું તો જીવન આપમેળે સુખમય બની

સવાલ નંબર 9

👉 સવાલ નંબર-9 પૂર્વભૂમિકા: બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... સવાલ: જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાથેસાથ શું શું કરવું જોઈએ?

👉 પ્રશ્ન સંખ્યા 9. પૃષ્ઠભૂમિ: સમી દુખોં કી જड़ में, अज्ञानता, आग्रह और अहंकार है जो कि एक व्यक्ति खुद स्वीकार नहीं कर सकता है फिर भी... एक ज्ञानी और सुखी जीवन बनाने के लिए वास्तव में क्या किया जाना चाहिए?

TOP-6-Urvi Shah (30) Ahmedabad, Gujarat

બધા જ દુઃખના મૂળમાં અજ્ઞાનતા, આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માર્ગાનુસારી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું. આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે ચોતરફ લોભ, ઈર્ષ્યા, અંધાધૂંધી, અશાંતિ જોવા મળે ત્યારે દરેક સમજદાર મનુષ્ય તેમાંથી U-turn લઈ અધ્યાત્મવાદ વિકાસ સાધવો જરૂરી બને છે.


માનસિક અને આત્મિક શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ ત્યારે જ થશે જ્યારે માનવી સરળ, નિખાલસ, અહિંસા, સત્ય, અયૌર્ય, પ્રામાણિકતા, બ્રહ્મચર્યને માર્ગે ચાલશે.

આ દુનિયામાં જે જે વસ્તુ દેખાય છે તે સંપૂર્ણ મિથ્યા છે. વાસ્તવિક જ્ઞાન સમ્યક્ત્વ જ્ઞાન છે જે મેળવવા સતત સુદેવ-સુગુરુ-સુધર્મના સાનિધ્યમાં રહી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના હંમેશા કરતા રહેવું. દરેક છદ્મસ્થ મનુષ્યે કસાય પર સંપૂર્ણ કાબુ રાખી વાસ્તવિક જ્ઞાન (કેવળજ્ઞાન) અને વાસ્તવિક સુખ (મોક્ષપ્રાપ્તિ) મેળવવા નિરંતર અને અથાગ પ્રયત્ન કરવો.

આજે સ્કૂલ કોલેજમાં મેકોલે દ્વારા પ્રસરાવેલ જ્ઞાન જીવનને દુર્ગતિમાં ધકેલનાર છે, ભૌતિક કે બાહ્ય સુખ એ ક્ષણિક છે જેથી તે મેળવવા દુર્લભ એવો માનવભવ ખર્ચો ન નાખતા શાશ્વત જ્ઞાન અને સુખ કે જે ભવો ભવ સુધારી જન્મ-મરણના ફેરા ટાળી સિદ્ધ અવસ્થાને આપનાર છે તે જ સત્ય છે.

ઉર્વિ શાહ — અમદાવાદ ગુજરાત

TOP-7-Pravina Shah (63) Mumbai Maharashtra



સવાલ નંબર 9

👉 સવાલ નંબર-9 પૂર્વભૂમિકા: બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... સવાલ: જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાથેસાથ શું શું કરવું જોઈએ?

👉 प्रश्न संख्या 9. पृष्ठभूमि: सभी दुखों की जड़ में, अज्ञानता, आग्रह और अहंकार है जो कि एक व्यक्ति खुद स्वीकार नहीं कर सकता है फिर भी... एक ज्ञानी और सुखी जीवन बनाने के लिए वास्तव में क्या किया जाना चाहिए?

TOP-8-Bhadra Dharamshi (74) Bagalkot,
Karnataka

M.No.-૧૦૩૬૧૦૭૫૧૬ ૐ ભક્તિ એમ. દારમશી તા.ડ- ૮-૨૦૨૦

સાનમય અને સુખમય જીવન બનાવવા માટે પ્રખ્યાત માર્ગ બતાવ્યા છે. (૧) કર્મમાર્ગ... "ઈશ્વરાપિતં નરેણ્યા દૃતમ્..."
મિત શીધકમ્ મુક્તિ સાધકમ્ "। રમણ મહર્ષિ તેમના ઉપદેશ સારમ્ "માં કહે છે કે એ કર્મ કોઈ ઉચ્ચ દરેયને સમર્પિત
કરી કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા વિના કરવામાં આવે તો કર્તવ્ય મન શુદ્ધ થાય છે. (૨) ભક્તિમાર્ગ... જે કર્મના
ફળને ઇશ્વરના ચરણોમાં અર્પિત કરે છે, ઇશ્વર-પરમેશ્વરના તિલક પ્રેમ દ્વારા પોતાના અંતઃકરણમાં પરમાત્માના સાક્ષાત્કાર
સમીપ માર્ગ છે અસ્તિત્વના સાચા તત્ત્વજ્ઞાનને સમગ્રવતો એક માર્ગ છે. રામાનુજચાર્યે બતાવેલા અગ્રીયાર
પાલનીશી પ્રાપ્ત થાય છે. વિલેક ... વિમોક ... સત્ય ... આર્જવ ... કિશા (બીજાનું ભલું કરવું) ... કલ્યાણ (સૌનું શુભ-
ઈચ્છવું) ... દયા ... અહિંસા ... દાન ... અનાવરનાદ (આનંદીત હોવું) ... ~~અનન્ય~~ (૩) સાનમાર્ગ... જમાનું
લક્ષ્ય માર્ગ છે. હું કોણ છું? હું શરીર મન અને બુદ્ધિની મર્યાદામાં બંધાયેલો નથી. ઉદયસ્થ વિનયજીએ "વિનય" નો
ઉત્તમ ગુણગણાવતાં માનની સજ્જતમાં કહે છે... માનના કિયમે માને વિનય ન આવે રે... વિનય વિના વિદ્યા નહીં
વો કેમ સમક્ષિત થાય રે... માન કર્યું રાવણે તો તે રામે માર્યો રે... દુર્યોધન ગર્વ કરે અંતે સવી દાર્યો રે...
જીવનમાં અહંકાર... અમાનતા ના કિયડને દડસેલી સાનમય સુખમય જીવન સુગંધીત બનાવીએ.

TOP-9-Preeti Lodaya (53) Karanja


M.No. - 9403873334
 કાર્ડનં - નામ: સોમિતો મહેન્દ્ર લોડાયા - કાર્ડનં - મહેન્દ્ર - તા. ૭-૮-૨૦૨૦
 મહારાષ્ટ્ર નંબર - ૭૦૨૦૦૬૬૭૭૭૭
 જવાબ:- માનવનું શરીર એ સુંદર ખેતર છે. સારા સંસ્કારો એ બીજ છે. સવરસોની વાણી એ પાણી છે. જીવ એ ખેડનાર ખેડૂત છે. આ પ્રમાણે ખેડાયેલા માનવ શરીર રૂપી ખેતરમાંથી આત્મા નિરાતિજાની, વિનયી, દાની, સરળ, ધર્મી, સત્કર્મી બને છે. જ્ઞાની બને છે. વિનય સંહિત પોતાના તથા બીજાના ઉદ્ધાર માટે પોતાનું જીવન અર્પણ કરતાં ધન્ય બને છે. અગો અર્હ નત્થો - મો'કોઈ." હું કોઈનો નથી. મારું કોઈ નથી. હે જીવ ! તું આત્માનું અનુશાસન કર. આઠ ધ્યાતિ કર્મોમાં બજવાન મોહનાય કર્મ છે. અર્હું અર્હું મમ - તેને દૂર કર. નહોતર કોઈ ઉત્પન્ન થાય છે. ને વિવેક બુદ્ધિ નાશ પામે છે. માટે "વિનય-પ્રજ્ઞા"માં ધીજ કર્મોના બંધન તૂટે છે. ને જીવનમાં સંતોષ આર્જીત પ્રગટવાથી શાન્તમય-સ્તુષ્પમય જીવન બને છે. ભરતબાહુબલીનું જ ક્ષર્યોત કહે છે - અરાન દશામાં અર્હાર આર્યું. પણ કર્મોના બંધન તૂટ્યા - વિનય પહું આર્યું - કેવળરાન પ્રાપ્ત થયું. માટે સત્કર્મો શુભ આચર્યું. સ્તુષ્પમય સૂર્યોદય થશેજ.

સવાલ નંબર 9

👉 સવાલ નંબર-9 પૂર્વભૂમિકા: બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા, આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં ... સવાલ: જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાથેસાથ શું શું કરવું જોઈએ?

👉 પ્રશ્ન સંખ્યા 9. પૃષ્ઠભૂમિ: સમી દુખોં કી જડ મેં, અજ્ઞાનતા, આગ્રહ ઓર અહંકાર હૈ જો કી એક વ્યક્તિ ખુદ સ્વીકાર નહીં કર સકતા હૈ ફીર મી... એક જ્ઞાની ઓર સુખી જીવન બનાવે કે લીએ વાસ્તવ મેં કયા કીયા જાના ચાહીએ?

TOP-10-Jagruti Rajesh Kumar Harde (58)
Mahesana, Gujarat



TOP-11-Bharti Kalpesh Gala

